



જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, કચ્છ-ભુજ

રૂમ નં.૪૧૧, ત્રીજો માળ, બહુમાળી ભવન,ભુજ-કચ્છ.

ફોન નં.૦૨૮૩૨-૨૨૩૭૭૧, E-mail : dsokutch771@gmail.com

જા.નં/જિ.ર.ગ./ખે.મ..કુ/રા.ટી.ટી/૨૮૫૬-૩૦૫૩/૨૦૧૮-૧૯

તા:૨૩/૧૦/૨૦૧૮

સુધારો

પ્રતિ,

જિલ્લા રમત ગમત અધિકારીશ્રી તમામ,

સીનીયર કોચશ્રી તમામ,

ગુજરાત રાજ્ય.

વિષય:- ખેલ મહાકુંભ-૨૦૧૮ રાજ્યકક્ષાની ટેબલ ટેનિસ અં-૧૪,અં-૧૭, અબવ-૪૦,અબવ-૬૦ ભાઈઓ/બહેનોની સ્પર્ધાનો વિગતવાર કાર્યક્રમ મોકલી આપવા બાબત.

સંદર્ભ:- આ કચેરીના તા.૧૨-૧૦-૨૦૧૮ના પત્ર ક્રમાંક/જરઅ/ખે.મ.કુ/રા.ટી.ટી./૨૭૩૧-૨૮૩૦-૨૦૧૮-૧૯

શ્રીમાન,

સવિનય ઉપરોક્ત વિષય પરત્વે જણાવવાનું કે, રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર અને સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા પ્રેરિત અને જિલ્લા વહીવટી તંત્ર કચ્છ દ્વારા આયોજિત અને જિલ્લા રમતગમત અધિકારી, કચ્છ-ભુજ સંચાલિત ખેલ મહાકુંભ-૨૦૧૮ અંતર્ગત રાજ્યકક્ષાની ટેબલ ટેનિસ અં-૧૪,અં-૧૭, અબજ-૪૦,અબવ-૬૦ વય ગ્રુપ ભાઈઓ/બહેનોની સ્પર્ધા તા: ૧૧/૧૧/૨૦૧૮ થી ૧૭/૧૧/૨૦૧૮ સુધી રમત સંકુલ, સર્વોદય સ્પોર્ટ્સ ગ્રાઉન્ડની બાજુમાં,માધાપર,તા.ભુજ યોજનાર છે. જેથી આપના જિલ્લાના ઓનલાઈન KMK નંબરવાળી ID ની એન્ટ્રી dsokutch 771@gmail.com ઉપર સમય મર્યાદામાં મોકલી આપવી પસંદગી પામેલ ખેલાડીઓને સમયસર જાણ કરવા વિનતી.

સ્પર્ધા તારીખ :- ૧૧/૧૧/૨૦૧૮ થી ૧૭/૧૧/૨૦૧૮

સ્પર્ધા સ્થળ :- રમત સંકુલ,સર્વોદય સ્પોર્ટ્સ ગ્રાઉન્ડની બાજુમાં, માધાપર, તા.ભુજ, જી.કચ્છ

નિવાસ તથા રિપોર્ટિંગ સ્થળ :- શ્રી નવચેતન અંધજન મંડળ, માહી ડેરીની સામે, હાઇવે રોડ,માધાપર,તા.ભુજ-કચ્છ

(માધાપર ગામથી ૧ કી.મી. પહેલા આવશે ત્યાં ઉતરવાનું રહેશે)

સંપર્ક નંબર :- ડી.એલ.ડાકી : ૯૪૨૮૩૧૧૪૭૫, કિશન બિજલાની -૯૪૬૦૩૭૧૮૬૯

નિવાસ :- શંકરભાઈ પટેલ-૯૮૭૯૦૫૨૦૮૮, રસીદ સમા- ૯૬૩૮૧૧૫૩૮૬, જયરામ વણકર- ૯૪૦૯૩૩૩૩૪૧૨

-: વિગતવાર કાર્યક્રમ :-


ક્રમ	વયજુથ	રીપોર્ટિંગ તારીખ / સમય	સ્પર્ધા તારીખ / સમય
૧	અંડર -૧૪ ભા/બ	૧૧/૧૧/૨૦૧૮ સાંજે ૫:૦૦ કલાકે	૧૨ થી ૧૩ નવેમ્બર-૨૦૧૮ સવારે ૯:૦૦ કલાકે શરૂ
૨	અંડર -૧૭ ભા/બ	૧૩/૧૧/૨૦૧૮ સાંજે ૫:૦૦ કલાકે	૧૪ થી ૧૫ નવેમ્બર-૨૦૧૮ સવારે ૯:૦૦ કલાકે શરૂ
૩	અબવ -૪૦,૬૦ ભા/બ	૧૫/૧૧/૨૦૧૮ સાંજે ૫:૦૦ કલાકે	૧૬ થી ૧૭ નવેમ્બર-૨૦૧૮ સવારે ૯:૦૦ કલાકે શરૂ

નોંધ :- અબવ-૧૭ ભાઈઓ/બહેનોની સ્પર્ધા યુનિવર્સિટીની પરિક્ષા હોવાથી હાલ મુલતવી રાખવામાં આવેલ છે.

-:અગત્યની સૂચનાઓ:-

(૧) ઓનલાઇન યુ.આઈ.ડી. નંબરવાળા સ્પર્ધકોને જ સ્પર્ધામાં ભાગ લેવા દેવામાં આવશે (૨) ટીમના દરેક ખેલાડીઓની ઓનલાઇન રજીસ્ટ્રેશનની પહોંચ ઉપર ફોટા ચોટાડી ફરજિયાત સાથે લાવવાની રહેશે. અથવા એલીજબીલીટી ફોર્મમાં ફોટા સાથે સહી-સિક્કા કરાવી લાવવાના રહેશે. અને આધાર કાર્ડ ફરજિયાત સાથે લઈ આવવાનું રહેશે. (૩) સ્પર્ધા/નિવાસ સ્થળે શિસ્ત બદ્ધ રીતે વર્તવાનું રહેશે. અશિસ્ત કરનાર વ્યક્તિ કે ટીમને સ્પર્ધામાંથી બાકાત કરવામાં આવશે. (૪) સરકારશ્રીના નિયમ મુજબ ટૂંકામાં ટૂંકા અંતરની મુસાફરી કરવાની રહેશે. મુસાફરીની ટીકીટ ટીમ મેનેજરે અવશ્ય રજૂ કરવાની રહેશે. (ખાનગી/લક્ઝરી બસનું પ્રવાસ ભાડું ચૂકવવામાં આવશે નહિ. ટીમ સાથે કોચ કામ મેનેજર તરીકે એકજ વ્યક્તિએ આવવાનું રહેશે. માત્ર બહેનોની સ્પર્ધા હોય ત્યારે માત્ર લેડીઝ મેનેજરને આવવાનું રહેશે. પ્રવાસ ભાડું RTGS/એકાઉન્ટ પે ચેક દ્વારા શાળા અથવા ટીમ મેનેજરના નામે ચૂકવવાનું હોવાથી પાસબુકની નકલ અથવા કેન્સલ ચેક પ્રવાસખર્ચ સાથે રજૂ કરવાનું રહેશે. (૫) નિવાસ સ્થળે નિયત ડીપોઝીટ જમા કરાવવાની રહેશે. સ્પર્ધા પૂર્ણ થયે જરૂરી ચીજવસ્તુ જમા કરાવ્યા બાદ ડિપોઝીટ પરત કરવામાં આવશે. (૬) ટીમ સાથે કોચ કમ મેનેજર તરીકેનો એકજ વ્યક્તિએ જિલ્લા રમત ગમત અધિકારીશ્રીના સહીવાળો ઓર્ડર લઈને આવવાનું રહેશે. (૭) ઋતુ અનુસાર ઓઢવા-પાથરવાનું તેમજ રૂમને લગાવવાનું તાળું પોતાની સાથે લાવવાનું રહેશે. તેમજ ખેલાડીઓએ કિમતી સામાન સાથે લાવવો નહી અન્યથા જવાબદારી તેની પોતાની રહેશે. (૮) ભાગ લેનાર ખેલાડીઓના જન્મતારીખ /રહેઠાણના જરૂરી આધાર પુરાવા સાથે લાવવાના રહેશે.

નોંધ: પરિપત્રની નકલ ટીમ મેનેજરને અવશ્ય આપવી.


જિલ્લા રમત ગમત અધિકારી
કચ્છ-ભુજ

નકલ રવાના જાણ સારૂ :-

- 1) માન. સચિવશ્રી, રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર
- 2) માન. કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર
- 3) માન. ડાયરેક્ટર જનરલશ્રી, સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર
- 4) માન. સચિવશ્રી સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર
- 5) માન. કલેક્ટરશ્રી, કચ્છ-ભુજ
- 6) માન. જિલ્લા વિકાસ અધિકારીશ્રી, કચ્છ-ભુજ
- 7) માન. જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી, કચ્છ-ભુજ (સ્પર્ધા, નિવાસ સ્થળે જરૂરી પોલીસ બંદોબસ્ત ફાળવવા વિનંતી)
- 8) માન. નિવાસી અધિક કલેક્ટરશ્રી, કચ્છ-ભુજ
- 9) માન. જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, કચ્છ-ભુજ
- 10) માન. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, કચ્છ-ભુજ
- 11) માન. પ્રાંત અધિકારીશ્રી, ભુજ
- 12) નાયબ માહિતી નિયામકશ્રી, કચ્છ (સ્પર્ધાની બહોળી પ્રસિદ્ધિ કરવા સારૂ)
- 13) સિનીયર કોચશ્રી રમત પ્રશિક્ષણ કેન્દ્ર, કચ્છ-ભુજ (સ્પર્ધા સ્થળની વ્યવસ્થા સારૂ)
- 14) જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, કચ્છ-ભુજ (સ્પર્ધા સ્થળે મેડીકલ ટીમ ફાળવવા વિનંતી)
- 15) મંત્રી/પ્રમુખશ્રી રાજ્ય કક્ષા ટેબલ ટેનિસ એસો. ગાંધીધામ-કચ્છ
- 16) પ્રમુખશ્રી કચ્છ જિલ્લા વ્યાયામશિક્ષક સંઘ.
- 17) મંત્રીશ્રી, શ્રી નવચેતન અંધજન મંડળ, માધાપર (નિવાસ વ્યવસ્થા સારૂ)